

To, Manager (Listing) BSE Limited Floor 25, P J Tower, Dalal Street, Mumbai -400001

Date: 04.02.2023

Re: Company Scrip Code: 505725

Subject: Newspaper Advertisement - Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015

Sir/Madam,

In compliance with the provisions of Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Newspapers Advertisement of Unaudited Financial Results for the quarter and nine months ended on December 31, 2022 published in Financial Express newspaper in English and Gujarati language on Saturday, February 04, 2023.

Please take the same on your records.

For Algoquant Fintech Limited

(Formerly Hindustan Everest Tools Limited)

For Algoquant Fintech Limited

Atul Kaushal

Company Secretary & Compliance Officer

ompany Secretary

M.No: A67692

#### NEWSPAPER ADVERTISEMENT Before the Central Government

Registrar of Companies, New Delhi In the matter of sub-section (3) of Section 13 of imited Liability Partnership Act, 2008 and rule 1. of the Limited Liability Partnership Rules, 2009.

In the matter of DINMAN ENTERPRISES LLP

having its registered office at 552, 5" Floor,

Plot No 8, Chandanwari Apartment,

Dwarka, Sector - 10, New Delhi-110075. Notice is hereby given to the General Public that the LLP proposes to make a petition to Registrar of Companies, Delhi under section 13 (3) of the Limited Liability Partnership Act, 2008 seeking permission to change its Registered office from the NCT of "Delhi" to the state of "Maharashtra". Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the LLP may deliver or cause to be delivered or send by Registered post of his/her objections supported by an affidavit stating the nature of his/her interest and grounds of opposition supported by an affidavit to the Registrar of Companies, Delhi, within 21 (twenty one) days from the date of publication of this notice with a copy to the petitioner LLP at its registered office at the address mentioned above.

For and on behalf of **DINMAN ENTERPRISES LLP** Sd/ Date: 04.02.2023 Pritesh Ranjan Place: Delhi Designated Partner

**JAGAT TRADING ENTERPRISES LIMITED** CIN: L74999DL1982PLC014411 Regd. Office: 208, Magnum House-II.

Karampura Community Centre,

New Delhi 110015

Website: www.jtel.co.in, Email: jagattradingenterpriseslimited@gmail.com

NOTICE

Pursuant to Provision of Regulation 47 and 29 of the SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation 2015, that a meeting of the Board of Directors of the Company is scheduled on Monday, 13th February 2023, to inter-alia consider Un-Audited Financial Results of the Company for the Nine Months / Quarter ended 31st December, 2022. In Terms of SEBI (Prohibition of Insider Trading) Regulation, 2015 and Company's internal code for prevention of insider trading, the trading window for dealing in securities of the company will remain closed from January 01, 2023 till Wednesday, 16 February

Stock Exchange (MSEI) website a www.msei.in and Company's website at www.jtel.co.in

The said notice may be accessed on the

Place: New Delhi

ORIX

No.

Account No. Loan

2023 (Both days inclusive).

By Order of the Board For Jagat Trading Enterprises Limited

Nirmal Kumar Taparia Company Secretary & Dated: 03.02.2023 Compliance Officer Place: New Delhi ACS: 14371

SUPREME COMMERCIAL ENTERPRISES

#### **LIMITED** Regd. Off.: Y-4-A-C, Loha Mandi, Naraina,

New Delhi - 110028 Ph.: 9350150766 Email Id: supremecommercial@gmail.com CIN: L51909DL1983PLC016724 Notice is hereby given pursuant to Regulation

29 (1) read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, 14th February, 2023 at Y-4-A-C, Loha Mandi, Naraina, New Delhi- 110028 at 02:00 P.M. to consider and approve Un-audited Standalone and Consolidated Financial Result of the Company for the quarter and nine months ended 31st December, 2022

Insider Trading) Regulations, 2015, Trading Window for dealing in securities of the Company is closed from 1st January, 2023 and will remain closed up to 48 hours of the conclusion of the Board Meeting in which Standalone and Consolidated Financia Result of the Company for the quarter and nine months ended 31st December, 2022 are to be considered and approved.

Further in pursuance of SEBI (Prohibition of

available on the website of the Company www.supremecommercial.co.in.

The information in the above notice is also

By the Order of the Board For Supreme Commercial Enterprises Limited Sd/ Date: 03.02.2023 (Ishika Garg) **Company Secretary** Place: Delhi

Form no INC-26 [Pursuant to rule 30 the Companies (Incorporation) Rules, 2014] Advertisement for the shifting of Registered

Office of the Applicant Company from NCT of Delhi to the State of Haryana BEFORE THE REGIONAL DIRECTOR. NORTHERN REGION, B-2 WING, 2nd FLOOR, DEENDAYAL ANTYODAYA BHAWAN CGO COMPLEX, NEW DELHI 110003

IN THE MATTER OF THE COMPANIES ACT, 2013. SECTION 13(4) OF COMPANIES ACT, 2013 AND RULE 30 OF THE COMPANIES (INCORPORATION) RULES, 2014

KAPO FOOTWEARS PRIVATE LIMITED (CIN: U74899DL1989PTC035111) HAVING ITS REGISTERED OFFICE AT H- 36 UDYOG NAGAR DELHI-110041 Notice is hereby given to the General Public that

IN THE MATTER OF

before the Regional Director under section 13 of the Companies Act, 2013 seeking approval of alteration of the Memorandum of Association of the Company in terms of the resolution passed at the Extra ordinary general meeting held on 27th January, 2023 to enable the company to change its Registered office from the "National Capital Territory of Delhi" to the "State of Haryana". Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company may deliver or cause to be delivered or send by registered post of his/her objections supported by an affidavit stating the nature of his/ her interest and grounds of opposition to the concerned Regional Director, Northern Region, B-2 wing, 2nd Floor, Deendayal Antyodaya Bhawan, CGO complex, New Delhi 110003 within fourteen days from the date of publication of this notice with a copy to the petitioner company at its registered office at the address mentioned below: Current registered office of the Company: Kapo Footwears Private Limited

H- 36 Udyog Nagar Delhi-110041 For and on behalf of the Applicant Kapo Footwears Private Limited

Place: Delhi (Ashim Kapoor) Date: 27.01.2023 Director DIN: 00987747

Add.: B-65, Pushpanjali Enclave Pitampura, New Delhi-110034

Notes:

Date: February 02, 2023

Place: New Delhi

**'IMPORTANT''** Whilst care is taken prior to copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or RAJASTHAN PETRO SYNTHETICS LIMITED

CIN-L17118RJ1983002658 Regd. Office: Flat No. 201, 8-B, Oasis Tower New Navratan Complex, Bhuwana, Udaipur-313001 (Rajasthan) E mail: investors@rpsl.co.in, Website: www.rpsl.co.in NOTICE

29 read with Regulation 47 of the Securities Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, a meeting of the Board of Directors of the Company will be held on Tuesday, the 14" February, 2023 at 03:00 p.m., inter alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended 31<sup>™</sup> December, 2022 and other items of agenda.

of the stock exchange www.bseindia.com

Place: New Delhi

#### NOTICE

Notice is hereby given that share certificate(s) nos. 9491-9492, 1/310. 28322, 34380, 39331-39332, 47436, 55383, 59840, 60744, 61759, 68814, 72254, 74289 to 74292, 76562, & 82970 for 1000 equity shares of F.V. Rs. 10 /- each bearing distinctive nos. 6246621 to 6246720, 6637571 to 6637620, 7188171 to 7188220, 7491071 to 7491120, 7738621 to 7738720, 8143871 to 8143920, 8541206 to 8541255, 8764056 to 8764105, 8809256 to 8809305, 8860006 to 8860055, 9212756 to 9212805, 9384756 to 9384805, 9486501 to 9486700, 9600151 to 9600200, & 9920551 to 9920600 under Folio No. 00071360 of M/s. SML ISUZU LTD., registered in the name of MANJULA JAIN has/have been lost and applied to the company to issue duplicate certificate(s). Any person who has/have any claim in respect of the said shares certificate(s) should lodge such claim with the company at its registered office Village Asron, Distt. Shahid Bhagat Singh Nagar, Nawan Shahr, Punjab, 144533, within 15 days of the publication of this notice, after which no claim will be entertained and the company will proceed to issue duplicate share certificate(s).

**MANJULA JAIN** 

#### DEUTSCHE BANK AG

Appendix IV [Rule 8 (1)] POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the **Deutsche Bank AG** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest. Act, 2002 (Act 54 of 2002) and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued a demand notice calling upon the borrowers on below mentioned date, to repay the amount mentioned in the notice, within 60 days from the date of receipt of the said

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general, that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said rule on said date.

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of the **Deutsche Bank AG** for an amount mentioned herein below beside with future interest and other expenses, cost, charges etc against the under mentioned account. The Borrowers attention is invited to provision of section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of the Borrower's / Guarantor's	Description of the Immovable Property	Outstanding Amount	Date of Demand
Limited ("Borrower"), Mr. Bimal Kumar Jain, Mr. Ramesh Kumar Jain, Mr. Abbey Ram	All that the self-contained residential property being: Plot No 50, Block No. HD, situated in Pitampura, New Delhi- 110034 Admeasuring 253 Sq. Mtrs. which is butted and bounded as follows: On The North By: Plot	(Rupees Eight Crore Thirty Three Lakhs Eighty Nine	Notice 23.11.2022
Jain, Deceased (Through all his	No. 51, On The South By: Plot No. 49, On The East By:	Eight And Paisa Forty Eight Only), and interest thereon.	Possession 02.02.2023
Limited ("Borrower"), Mr. Bimal Kumar Jain, Mr. Ramesh Kumar Jain, & Mrs. Raj Bala Jain ("Co-Borrowers)	All that the self-contained residential property being :- Plot No 21, Block No. ZP, situated in Pitampura, New Delhi- 110034 Admeasuring 98 Sq. Mtrs. which is butted and bounded as follows On The North By: Road, On The South By: S/Lane, On The East By: Plot No. 22, On The West By: Road 7 Mtr wide, ("Property")	(Rupees Three Crore Seventeen Lakhs Twenty Four Thousand Seven Hundred Twenty Six And Paisa Sixty Six	18.11.2022

**ORIX Leasing & Financial Services India Limited** (formerly known as OAIS Auto Financial Services Limited) (A Subsidiary of ORIX Auto Infrastructure Services Limited) Regd. Office: Plot No. 94, Marol Co-operative Industrial Estate, Andheri-Kurla Road, Andheri (E), Mumbai - 400 059

Tel.: + 91 22 2859 5093 / 6707 0100 | Fax: +91 22 2852 8549 Email: info@orixindia.com | www.orixindia.com | CIN: U74900MH2006PLC163937 (Notice under Section 13 (2) of the Securitisation and Reconstruction of Financial

Assets and Enforcement of Security Interest Act, 2002)

borrowers per 13(2) Notice Date

The following borrowers and co-borrowers availed the below mentioned secured loans from ORIX Leasing & Financial Services India Limited. The loans of the below mentioned borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to the terms and conditions of the respective loan agreements and had become irregular, their loans were classified as NPA as per the RBI Guidelines. Amounts due by them to ORIX Leasing & Financial Services India Limited, are mentioned as per the respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates Type of Name of Outstanding as Notice Details of

-	140.	Account No.	Loan	Dollowers	per 13(2) Nonce	Date	Secured asset
	1	LN0000000010144	Sme Secured Loan	1. Om Prakash 2. Krishan Kumar 3. Rashmi 4. M/S Prakash Property Mart	3,16,70,412.61	20-Jan-23	ALL THAT PIECE AND PARCEL OF PLOT NO. 10-C, LAND AREA 1440 SQ. MTRS. AND 14854 SQ. FT. (BUILT-UP AREA), SITUATED AT SECTOR/VILLAGE: TUGALPUR HALDONA, KNOWLEDGE PARK PHASE-III, GREATER NOIDA, DISTRICT: GAUTAM BUDH NAGAR (U.P.)
	2	LN0000000019319/ LN0000000007768	Sme Secured Loan	<ol> <li>M/S Divisha Car Wash N Detailing</li> <li>Kulvinder Singh</li> <li>Dharam Singh</li> <li>Yashvinder Singh</li> </ol>	1,81,88,745.78	20-Jan-23	ALL THAT PIECE AND PARCEL OF PROPERTY NO. 52A/2, LAND AREA ADMEASURING 219 SQ. YDS., OUT OF KHASRA NO. 824, SITUATED AT VILLAGE: MUNIRKA, NEW DELHI, DELHI-110067
	3	LN000000010214/ LN0000000016580	Sme Secured Loan	1. SUNDARI DEVI 2. MEWA RAM 3. HEMAT KUMAR	72,33,115.85	20-Jan-23	H-118, PLOT AREA 150 SQ. YDS. AND 4840 SQ. FT. (BUILT-UP AREA), SITUATED AT KHASRA NO. 93/3, HARKESH NAGAR, NEW DELHI, DELHI
	4	LN0000000003914	Sme Secured Loan	1. Sudershan Gupta 2. Suman Gupta	63,59,738.01	20-Jan-23	ALL THAT PIECE AND PARCEL OF BUILT-UP PORTION, THE PROPERTY MPL. NO.3729-B, GALI NO.1, MEASURING 54. SQ YDS. I.E., 45.36 SQ MTRS COMPLETE BUILT-UP GROUND, FIRST AND SECOND FLOOR WITH ROOF RIGHTS (TOTAL PLINTH AREA 136.08 SQ. MTRS.) OUT OF PLOT NO.177, (MGR. 125 SQ. YDS.), SITUATED LAND IN THE AREA OF VILLAGE CHOWKRI MUBARKABAD, STATE DELHI, ABADI/COLONY ALSO KNOWN AS GANESHPURA, KANHIYA NAGAR, TRI NAGAR, DELHI-35
	5	LN0000000008245/ LN00000000007617	Sme Secured Loan	Sarthak Paints     And Sanitation     Pooja Aggarwal     Nikunj Aggarwal	65,68,451.13	20-Jan-23	ALL THAT PIECE AND PARCEL OF PLOT AREA 70 SQ. YDS, KHASRA NO. 209 (0-6), (AS PER PROPERTY TAX RECEIPT PLOT NO. 206, GALI NO. 2, KHASRA NO. 209), SITUATED IN THE EXTENDED LAL DORA ABADI OF VILLAGE: KAPASHERE, NEW DELHI
	6	LN0000000019103/ LN0000000014430	Sme Secured Loan	1. Raj Kumar 2. Nirmala	39,85,944.21	20-Jan-23	ALL THAT PIECE AND PARCEL OF PROPERTY NO. 3593/31 (NEW NO. 3603), PLOT AREA 100 SQ. YDS., KHASRA NO. 13, 5573/15, SITUATED AT MOUJA SIWANA GURGAON, RAJENDRA PARK, GURGAON, HARYANA
	7	LN0000000012384/ LN0000000018580	Sme Secured Loan	1. AMIT SAXENA 2. JAGJEET KAUR	72,31,377.58	20-Jan-23	NEW NO. F-21, PLOT NO. 5, LAND AREA ADMEASURING 50 SQ. YDDS., AND 1014 SQ. FT. (BUILT-UP AREA), SITUATED AT MUKHRAM GARDEN, TILAK NAGAR, NEAR RAJ CINEMA, CHOUKHANDI CHOWK, DELHI-110018

You are hereby called upon to pay the amounts due to ORIX Leasing & Financial Services India Limited as per details shown in the above table with contracted rate of interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the date of this publication, failing which the undersigned shall be constrained to initiate proceedings U/s 13(4) and Sec. 14 of the SARFAESI Act, against the mortgage properties mentioned herein above to realize the amount due to ORIX Leasing & Financial Services India Limited. Further you are prohibited U/s 13(13) of the said Act from transferring the said secured asset either by way of sale / lease or otherwise

Date: 03.02.2023 Sd/- Authorised officer Place : Delhi **ORIX Leasing & Financial Services India Limited** 

ALGOQUANT FINTECH LIMITED (FORMERLY HINDUSTAN EVEREST TOOLS LTD.) Registered office: Unit No. 705, 07th Floor of ISCON Elegance, Plot No. 24, Prahaladnagar, Ahmedabad-380015, Gujarat CIN: L74110GJ1962PLC136701, Ph:+91-9910032394 E-mail: investors@algoquantfintech.com, Website: www.algoquantfintech.com

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2022

(Rs. In Lakh Except earnings per share)										
5 // 1	C	Quarter ende	d	Nine mon	Nine months ended					
Particulars	31-12-2022 (Unaudited)		31-12-2021 (Unaudited)	31-12-2022 (UnAudited)		31-03-2022 (Audited)				
Total income from operations	582.02	719.78	516.67	1291.34	1176.23	1710.33				
Net Profit /(Loss) for the period (before Tax,										
Exceptional and/or Extraordinary items#)	197.77	362.58	22.02	367.94	261.92	316.42				
Net Profit /(Loss) for the period before tax										
(after Exceptional and/or Extraordinary items#)	197.77	362.58	22.02	367.94	261.92	316.42				
Net Profit / (Loss) from discontinued operations for the period										
after tax (after Exceptional and/or Extraordinary items#)	(2.81)	21.36	0.00	15.74	24.70	19.08				
Total Comprehensive Income for the period										
[Comprising Profit / (Loss) for the period (after tax)										
and Other Comprehensive Income (after tax)]	592.10	190.81	(85.58)	1006.56	921.28	1342.75				
Paid up Equity Share Capital (Face Value of Rs. 2/- each)	160.72	160.72	160.72	160.72	160.72	160.72				
Other equity	-	-	-	-	-	3193.45				
Earning Per Share from continuing operations										
(Not annualised) (a) Basic (Rs.)	2.26	3.31	0.31	3.94	2.94	4.03				
(b) Diluted (Rs.)	2.26	3.31	0.31	3.94	2.94	4.03				
Earning/ (Loss) Per Share from discontinued	2.20	3.31	0.51	3.94	2.94	4.03				
operations (Not annualised)										
(a) Basic (Rs.)	(0.04)	0.27	0.00	0.20	0.31	0.24				
(b) Diluted (Rs.)	(0.04)	0.27	0.00	0.20	0.31	0.24				
Earning/ (Loss) Per Share from continuing and	(0.04)	0.27	0.00	0.20	0.31	0.24				
9 ( )										
discontinued operations (Not annualised) (a) Basic (Rs.)	2.22	3.58	0.31	4.13	3.25	4.27				
(b) Diluted (Rs.)	2.22	3.58	0.31	4.13	3.25	4.27				
∥ (b) Dilutea (⊾2.)	L. Z.ZZ	3.58	U.3T	4.13	J.Z5	4.27				

The above Statement of "Unaudited Standalone Financial Results" for the quarter ended December 31, 2022 ("the Statement") has been reviewed by the audit committee and approved by the Board of Directors in its meeting held on February 02, 2023. The Statutory Auditors have issued an un-modified opinion on the Statement.

The financial results have been prepared in accordance with the recognition and measurement principles of Indian Accounting

Standards prescribed under section 133 of the Companies Act. 2013 read with relevant rules framed thereunder and other accounting principles generally accepted in India. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the quarterly Standalone Financial

Results are available on the Exchange website www.bseindia.com and the Company's website www.algoguantfintech.com FOR AND ON BEHALF OF BOARD OF DIRECTORS

> Devansh Gupta Managing Director DIN: 06920376

ALGOQUANT FINTECH LIMITED

# HERO HOUSING FINANCE LIMITED

Registered Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Branch Office: 27, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057.

#### PUBLIC NOTICE (E- AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTY)

[UNDER RULE 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002] Notice For Sale Of Immovable Property Mortgaged With Hero Housing Finance Limited (secured Creditor) Under The Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002. Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) or

their legal heirs/representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 24-Feb-2023 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co- Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The sealed envelope containing Demand Draft of EMD for participating in Public Auction shall be submitted to the Authorised Officer of Hero Housing Finance Ltd. On or before 23-Feb-2023 till 5 PM at Branch Office: Building No.27, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi- 110057.

Loan	Name of Borrower(s)/ Co-	Date of		Reserve Price	
Account	Borrower(s)/ Guarantor(s)/	Demand Notice	(Under Constructive/	Earnest	
No.	Legal Heir(s)/ Legal Rep.	Amount as on date	Physical)	Money	
HHFDEL HOU2000	ASHA KAUR, IQBAL SINGH,	18/11/2021 Rs. 21,21,656/-	Physical	Rs. 12,00,000/-	
0007647		as on 02/02/2023	Possession	Rs.1,20,000/-	

Rz-9/16. Gali No. 11. Khasra No. 500 Min, Tughlakabad Extension, New Delhi-110019, Having Area Measuring 50 Sq. Yds. Consisting Of Two Bedrooms, Drawing/dining, Kitchen And Bathroom More Mentioned in The Sale Deed, Bounded By: North: Other's Property East: Main Road: South: Other's

HHFDELHOU1900	CHANDAN PRASAD,	30/09/2021	Physical	Rs.
0004341, HHFDEL	BINITA DEVI	Rs. 21,68,381/-	Possession	13,00,000/-
IPL19000004637	YHSS33070540376	as on 02/02/2023	1 000000000	Rs. 1,30,000/-

Om Vihar Extn. Uttam Nagar, New Delhi-110059 Having Area Measuring 44 Sq. Yds I.e. 36.79 Sq Mtrs Bounded By: North: Plot No. E - 14 F East: Portion Of Plot: South: Road West: Plot No. E - 12

Terms and condition: The E-auction will take place through portal https://sarfaesi.auctiontiger.net

on 24-Feb-2023 (E-Auction Date) between 2.00 PM to 3.00 PM with limited extension of 10 minutes each, 1)The prescribed Tender/ Bid Form and the terms and conditions of sale will be available with the Branch Office: 27, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057, between 10,00 a.m. to 5,00 p.m. on any working day, 2)The immovable property shall not be sold below the Reserve Price. 3)Bid increment amount shall be Rs. 10,000/- (Rupees Ten Thousand Only). 4)All the bids/ tenders submitted for the purchase of the above property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favouring the "HERO HOUSING FINANCE LTD." payable at Delhi. The Demand Drafts will be return to the unsuccessful bidders after auction. 5)The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be the discretion of the Authorised Officer to decline/ acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. 6) The prospective bidders can inspect the property on 16-Feb-2023 between 11.00 A.M and 2.00 P.M with prior appointment. 7) The person declared as a successful bidder shall, immediately after the declaration deposit 25% of the amount of purchase money/ highest bid which would include EMD amount to the Authorised Officer within 24 Hrs. and in default of such deposit, the property shall forthwith be put to fresh auction/sale by private treaty, 8) in case the initial deposit is made as above, the balance amount of the purchaser money payable shall be paid by the purchaser to the Authorised Officer or or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day or if the 15th day be a Sunday or other holiday, then on the first office day after the 15th day. 9) In the event of default of any payment within the period mentioned above, the property shall be put to fresh auction/ sale by private treaty. The deposit including EMD shall stand forfeited by Hero Housing Finance Ltd. and the defaulting ourchaser shall lose all claims to the property, 10). The labove sale shall be subject to the final approval of Hero Housing Finance Ltd. 11) Details of any encumbrances, known to the HERO HOUSING FINANCE LTD, to which the property is liable: Not Known. Claims, i any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value: Not Known, 12) interested parties are requested to verify/confirm the statutory and other dues like Sales/Property tax, Electricity dues, and society dues, from the respective departments / offices. The Company does not undertake any responsibility of payment of any dues on the property, 13)TDS of 1%, if any, shall be payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be deposited by the highest bidder in the PAN of the company and the copy of the challan shall be submitted to the company. 14) Sale is strictly subject to the terms and conditions incorporated in this advertisement and in to the prescribed tender form. 15) The successful bidder/purchaser shall bear all stamp duty, registration fees, and incidental expenses for getting sale certificate registered as applicable as per law. 16) The Authorised Officer has the absolute right to accept or reject the bid or adjourn / postpone / cancel the tender without assigning any reason thereof and also to modify any terms and conditions of this sale without any prior notice, 17)Interested bidders may contact Mr. Rai Mishra at Mob. No. 9971808985 during office hours (10.00AM to 6.00 PM) or mail on assetdisposal@herohfl.com by mentioning the account no. of property/borrower. 18) For any other details or for procedure online training on e-auction the prospective bidders may contact the Service Provider, M/s e-Procurement Technologies Limited Auctiontiger), Mob.:9173528727 & Phone : 079-68136842 , Email ID: Maulik.shrimali@auctiontiger.net. & support@auctiontiger.net. Please send your query on WhatsApp Number-9173528727

## 15 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR

mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be recovered with interest and cost from you.

https://uat.herohomefinance.in/hero\_housing/other-notice\_on Hero Housing Finance Limited Secured Creditor's) website i.e www.herohousingfinance.com For Hero Housing Finance Ltd.

Date: 04-Feb-2023 Place: Delhi/NCR



केनरा बैंक 🛆 Canara Bank THE RESIDENCE

Branch: 42 km Milestone, Seekri, Ballabhgart District Faridabad, Haryana-121004

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) Whereas: The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 21/03/2022 calling upon the borrower Mubarik S/o Mr.

and paisa Sixty Two only ) within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described nerein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act,

Habib Vill Sikri Tehsil Ballabhgarh to repay the amount mentioned in the notice, being

Rs.11,32,886.62 (Rupees Eleven Lakh Thirty Two Thousand Eight Hundred Eighty Six

read with Rule 8 & 9 of the said Rule on this 01st day of February of the year 2023 The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs.11,32,886.62 ( Rupees Eleven Lakh Thirty Two Thousand Eight

Hundred Eighty Six and paisa Sixty Two only) and interest thereon. The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in

respect of time available, to redeem the secured assets. Description of the Immovable Property

### All that part and parcel of the Property Gair Mumkin of the extent of 7/153VPO seekri

comprised in knewat khatoni no. 48/56 khasra no 53 kila no 21(7-13) the share of the applicant comes 0 kanal 7 marla /ie 200 sq. yds. VPO seekri The Ballabhgarh Distt. Faridabad. Bounded: On the North by: Other's Property. On the South by: Other's Property, On the East by: Other's Property, On the West by: Rasta 16'. Authorised Officer, Canara Bank

Date: 04-02-2023 Place: Sikri

#### SKYWEB INFOTECH LIMITED

Tel.: 0120-2406450 I Email: info@skywebindia.in I Web: www.skywebindia.in CIN No.: L72200DL1985PLC019763 POSTAL BALLOT NOTICE

(Pursuant to Section 110 of the Companies Act, 2013)

Reg. Office: K-20, 2nd Floor, Lajpat Nagar-II, New Delhi-110024

NOTICE is hereby given that pursuant to the provisions of Section 110 and othe applicable provisions, if any, of the Companies Act, 2013 (the "Act") and the Companie Management & Administration) Rules, 2014 read with Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 22/2020 dated une 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020, Circular No. 39/2020 dated December 31, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circula No. 10/2021 dated June 23, 2021, Circular No.20/2021 dated December 8, 2021 and ircular No.3/2022 dated May 5, 2022, issued by the Ministry of Corporate Affairs MCA") (hereinafter collectively referred to as "MCA Circulars"), and such othe

rovisions, laws and regulations, if any, Skyweb Infotech Limited ("the Company") i

eeking consent of its members for the special business as set out in the Postal Ballo

otice dated 03rd February, 2023. he Company has sent the Postal Ballot Notice by e-mail on February 03, 2023 to all he Members whose e-mail addresses are registered with the Company/Depository Participants as on Friday, January 27, 2023 ("Cut-off Date"). In compliance with the aforesaid MCA Circulars, this Postal Ballot Notice is being sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company, Depositories as on cut-off date i.e. January 27, 2023. Hard copy of the Postal Ballot Notice, Postal Ballot Form and pre-paid business reply envelope will not be sent to the nembers for this Postal Ballot, therefore, members are required to communicate their issent or dissent through the remote e-voting system only. Members who have not yet registered their e-mail addresses are requested to get their

-mail addresses registered by writing to the Registrar and Share Transfer Agent (RTA) M/s Beetal Financial and Computer Services Private Limited ("Beetal") at its e-mail ID beetal@beetalfinancial.com or beetalrta@gmail.com Members whose names are recorded in the Register of Members/ Register of

on Friday, January 27, 2023 ("Cut-off Date") are entitled to avail the facility of remote e-voting and their voting rights shall be reckoned on the basis of their holding as on The Notice of the Postal Ballot will also be available on the Company's website www.skywebindia.in, website of the Stock Exchange i.e. Metropolitan Stock Exchange of India Limited at www.msei.in and on the website of CDSL www.evotingindia.com.

Beneficial Owners maintained by the Depositories/Registrar of Share Transfer Agent as

The business as set out in the notice shall be transacted only through remote

The remote e-voting period will commence from Saturday, February 04, 2023 a 9:00 A.M. (IST) and ends on Sunday, March 05, 2023 at 5:00 P.M. (IST); The remote e-voting module shall be disabled by CDSL beyond 5:00 P.M. on

Once the vote on a resolution is cast by a member, he/she shall not be allowed to change it subsequently. The detailed procedure/instructions for e-voting are contained in the Notice of Postal

M/s. S.K. Batra & Associates, Practicing Company Secretaries, has been appointed as

Scrutinizer by the Board of Directors of the Company pursuant to Rule 22(5) of the Companies (Management & Administration) Rules, 2014 for conducting entire Postal Ballot through remote e-voting process in a fair and transparent manner. The results of the Postal Ballot will be announced within 2 days of conclusion of remote e-voting i.e. on or before March 07, 2023 by the Chairman or in his absence by any

other person authorized by him, at the Corporate Office of the Company and will be intimated to Stock Exchanges, published in the newspapers and also be displayed along with the Scrutinizer's Report on the website of the Company www.skywebindia.in. and will also be communicated to the Stock Exchange i.e. Metropolitan Stock Exchange of ndia Limited at www.msei.in, where the shares of the Company are listed. For any grievances / gueries connected with the voting by Postal Ballot including voting by electronic means, shareholders may refer the Frequently Asked Question and e-voting manual available at www.evotingindia.com under help section or write a

email to helpdesk.evoting@cdslindia.com or contact Mr. Rakesh Dalvi (022-23058542) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futures Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai-400013. By order of the Board of

Skyweb Infotech Limited Yamini

Company Secretary & Compliance Officer

Place : Delhi

Date: 03rd February, 2023

Members are hereby informed that:

March 05, 2023;

प्र० का० : बाजपुर रोड, आवास विकास, काशीपुर-244713 जिला उधम सिंह नगर



Kashipur Urban Co-operative Bank Ltd. काशीपुर अर्बन को-ऑपरेटिव बैंक लि०,

दूरभाष : 05947-276307, ईमेल: kucbltd@yahoo.co.ir

#### **Public Auction Notice (Related to Immovable Property)** It is informed to the general public that the following property which was mortgaged in favour of the bank for the repayment of the loan given by the bank, which

has been received by the bank in actual possession with the help of the police force, by the order of the Honourable Collector/ District Magistrate Udham Singh Nagar. By this notice, the general public and the mortgagors are publicly informed that the sale of the property shown below for the recovery of the outstanding amount is as it is under the Securitization and Reconstruction of financial assets and security, under the provision of Interest Enforcement Act 2002 and Security Interest (Enforcement) Rules 2002 will be as follows Date of auction Name of Borrower Description and balance of the property and Amount Reserve

No		Owner's Name	Due	Money	(Place and Time)
1	1.Wasid Khan S/o Wahid Khan 2.Wahid Khan S/o Shahid 3.Smt. Naaj W/o Wasid Khan Partners M/S M.K Electricals R/o Chakarpur Road, Turn of Dr. Pandey, in front of Dr. Raj, Bazpur	All that part and parcel of the property consisting Khasra No. 340 min situated at Vill. Mundiya Pistor Teh. Bazpur Distt. U.S.Nagar Khasra No 340 min area 32.5 x 47.08 = 1530.1 Sqfit or 142.20 Sqrmtr bounded by in East Plot Anita Sachdev, in West Plot Jagjeet Singh, in North Rasta 20 fit Wide, in South Property Malvindra pal which is Registered at Bahi No. 1st Zild No. 2170 on pages 393-408 at SI No. 5660 dated 03.08.2015 in office of Sub Registrar Bazpur Distt. U.S.Nagar in the name of of Wasid Khan S/o Wahid Khan Partner M/S M.K Electricals R/o Chakarpur Road, Turn of Dr. Pandey, in front of Dr. Raj, Bazpur	1906531.14 + Interest + other Charges	/- 2222000.00/-	£ 1
	Distt. U.S.Nagar. (Borrower)				

INSTRUCTION-For more information about the auction property contact Authorized Officer of the Kashipur Urban Co- Operative Bank Ltd. The Authorized Officer reserves the right to extend the due date or cancel it without assigning any reason therefore, it is advisable to check at your own. The property is being sold with known and unknown encumbrances of the present and future. The authorized officer will not be responsible for any kind of third/ other party's claim rights and liabilities. Bidder can inspect the title deed at the Head Quarter on the date 22-02-2023 before the auction. Bidder can participate in the bid only after being fully satisfied about the property. Whereas this Notice as per Rule 8(6) of the SARFAESI Act 2002 is also hereby given to the Borrower(s)/ Guarantor(s) Mortgagor(s) of the said loan regarding holding of auction of the above said property on the above mentioned date. They are requested to be present and cooperate in the auction. In case of failure of the auction, the Bank reserves the right to sell the property to the private entity. Terms and Conditions & 1-It is mandatory for the bidder participating in the auction to deposit a bank draft for an amount equal to Five percent (5%) of the reserve price drawn in favor of any Scheduled Bank / Kashipur Urban Co-operative Bank Ltd payable in favor of EMD before the time of the auction. It is also necessary to bring Identity Card and PAN card at the time of the auction. 2- The one who will bring the highest bid before the authorized officer will be declared as the successful bidder. The successful bidder will have to deposit Twenty Five percent (25%) of the reserve amount immediately, if he/she is unable to do so, the security deposit will be forfeited. The amount deposited by the bidder will be included in the price. 3- Within Fifteen (15) days after confirmation of sale of permanent property in favor of the buyer, the balance amount will have to be deposited with the concerned officer and between the two parties. The buyer will have to deposit the amount with in the time after the written information given by the concerned officer regarding extension of time. In the event of the buyer not depositing Seventy Five percent (75%) of the amount within the stipulated date, the auction will be canceled and held again under full authority of the authorized officer. 4- The authorized officer reserved the right to accept or reject the final bid. 5-The terms and conditions related to the property will be declared by the authorized officer at the auction time. 6-Bid less than the reserve price will not be accepted.7-Any officer, employee or committee members of the bank are debarred from participating in the bid. Authorized Officer, Kashipur Urban Co-Operative Bank Ltd Date : 04-02-2023, Place - Kashipur



### ADITYA BIRLA HOUSING FINANCE LIMITED Registered Office- Indian Rayon Compound, Veraval, Gujarat - 362266

Branch Office- G Corporation Tech Park, Kasarvadavali, Ghodbunder Road, Thane -400607 (MH)

# DEMAND NOTICE

(under Rule 3 (1) of Security Interest (Enforcement) Rules, 2002)

SUBSTITUTED SERVICE OF NOTICE U/s.13 (2) of SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETSAND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 Notice is hereby given to the borrowers as mentioned below that since they have defaulted in repayment of the Credit facility availed by them from Aditya Birla Housing Finance Limited (ABHFL) their loan accounts have been classified as Non-Performing Assets in the books of the Company as per RBI guidelines thereto. Thereafter, ABHFL has issued demand notices under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESIAct) on the last known addresses of the said borrowers thereby calling upon and demanding from them to repay the entire outstanding amount together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, cost, charges etc. as stated in the said demand notices. However, the demand notice is also being served by way of publication, as per Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (SARFAESI Rules):

W	Co-Guarantor & Loan A/C No.	NPA Date	Demand Notice	Demand Notice / as on Date
Г	1 1. Vishal Gupta, 2. Rachna Gupta, T-204, Parsavnath Gardenia, Sector-61, Noida, Gautam Buddh Nagar, Uttar			Rs. 1,51,08,465.76/- (Rupees One Crore Fifty One
ı	Pradesh-201301, 3. Vishal Gupta, C/o Hytech Professional India Pvt Ltd., 4. Rachna Gupta C/o Hytech	13.01.2023	31.01.2023	Lakh Eight Thousand Four Hundred Sixty Five and
ı	Professional India Pvt Ltd, A-89, Sector-63, Noida, Goutam Budh Nagar, Uttar Pradesh- 201301, 5. Vishal			Seventy Six Paise Only) by way of outstanding
ı	Gupta, 6. Rachna Gupta, Apartment No. Vs-7/bunglow No. 3, 3rd Floor, Rise Skybungalows, Plot No. Gh-02			principal, arrears (including accrued late charges)
ı	Sector-41, Faridabad, Haryana-121003. Loan Account No. LNDELPHL-05150023540	a 80		and interest till 25.01.2023
	Encounting of Improved to managers / managers of managers of All That Disco And Days of Of Anagers of No. 1/	- 7/h	No. 2 Op. 1	hind Floor Advance winer 2200 Cm. Et. In The Duilding

Secto Description of Immovable property / properties mortgaged: All That Piece And Parcel Of Apartment No. Vs-7/bungalow No. 3, On Third Floor, Admeasuring 2300 Sq. Ft., In The Building Known As "Rise Skybungalows" Situated At Plot No. Gh-02, Sec-41, Faridabad (Haryana). We hereby call upon the borrower stated herein to pay us within 60 days from the date of this notice, the outstanding amount (s) together with further interest thereon plus cost, charges, expenses, etc. thereto

failing which we shall be at liberty to enforce the security interest including but not limited to taking possession of and selling the secured asset entirely at your risk as to the cost and consequences. Please note that as per section 13(13) of the SARFAESI Act, all of you are prohibited from transferring by way of sale, lease or otherwise, the aforesaid secured assets without prior written consent of the Company, Any contravention of the said section by you shall invoke the penal provisions as laid down under section 29 of the SARFAESI Act and / or any other legal provision in this regard. Please note that as per sub-section (8) of section 13 of the Act, if the dues of ABHFL together with all costs, charges and expenses incurred by ABHFL are tendered to ABHFL at any time before the date fixed for sale or transfer, the secured asset shall not be sold or transferred by ABHFL, and no further step shall be taken by ABHFL or transfer or sale of that secured asset.

Date: 04.02.2023

Place: Harvana

New Delhi

(Aditya Birla Housing Finance Limited

Sd/- Authorised Office

financialem epar

entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Notice is hereby given that pursuant to Regulation The notice is also available on website of the company www.rpsl.co.in and also on the website

By Order of the Board

For Rajasthan Petro Synthetics Limited B.R. Goyal Date: 03.02.2023

Date: 04-02-2023 Place: Delhi

Name of the shareholder:

Deutsche Bank A.G.

Secured asset

HOL 0007 Description Of Property: Third Floor (back Side Portion), Without Terrace Rights Of Property No Property West: Service Lane

The above mentioned Borrower/Mortgagor/guarantors are hereby noticed to pay the sum as

For detailed terms and conditions of the sale, please refer to the link provided in

Authorised officer, Mr. Lakshay Chuttani , Mob- 9878829899 Email;assetdisposal@herohfl.com

#### કબજા નોટીસ DCB BANK (સ્થાવ૨મિલકત માટે)

માથી ડીસીબી બેંક લીમીટેડના નીચે સહી કરનાર અદિાકત અધિકારીએ સિક્યોરીટાઇજેશન અને રીકન્સ્ટક્શ ઓફ ફાચનાન્સિચલએસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફર્સિક્ચોરીટીઇન્ટરેસ્ટએક્ટ, ૨૦૦૨ હેઠળ અને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ સાથે દાંચાતી કલમ ૧૩(૨) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને **૨૭.૦૨.૨૦૨૦** ના રોજ માંગણા નોટીસ જારી કરી **યુખરાજ મિશ્રીલાલજી રાજ્યુરોહિત અને કમળાબેન** પુખરાજભાઇ રાજપુરોહિત અને હિંગળાજ ગ્રેનાઇટ એન્ડ માર્બેલ્સ ને નોટીસમાં જણાવેલ ૨૬મ રૂા . ૨૨,૨૮,૨૪૪.૫૮/– (રૂપિયા બાવીસ લાખ અઠ્યાવીસ હજાર બસ્સો ચુમ્માલીસ અને અઠાવન પૈસા પુત્ર) **૨૬.૦૨.૨૦૨૦** મુજબની ડીસીબી બેંક લીમીટેડની બાકી ૨કમ જણાવેલ નોટીસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની અંદર ચુકવવા જણાવ્યું હતું.

દેવાદારોં અને જામીનદારો રેકમનીપરત ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી ખાસ કરીને દેવાદાર/જામીનદારો અને જાહેર જનતાને જાાગ કરવામાં આવે છે કે આ નિયમોના નિયમ ૯ સાથે વંચાતી જગાવેલ કાયદાની કલમ ૧૩ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જ્યાવેલ મિલકતનો કબજો **રહ જાન્યુઆરી, ૨૦૨૩** ના રોજલઇ લીદ્યો છે.

ખાસ કરીને દેવાદારો અને જામીનદારો અને જાહેર જનતાને મિલકત સાથે કોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ડીસીબી બેંક લીમીટેડની રકમ **રૂ. ૨૨,૨૮,૨૪૪.૫૮/– (રૂપિયા બાવીસ લાખ** અક્યાવીસ **હજાર બરસો ચુમ્માલીસ અને અઠાવન પૈસા પુત્ર) ૨૬,૦૨.૨૦૨૦ મુજ**ળ લોન એકાઉન્ટ નંબર DRBLCGR00408382 ની અને પુરેપુરી પરત ચુક્લણી સુધી તેના પરના ચડત વ્યાજના ચાર્જને આદિન રહેશે.

સ્થાવરમિલકતની વિગત મકામ-૨૯. જ્યુ અદિતી પાર્ક ટેનામેન્ટ સે હાઉસ. ક્ષેત્રકળ ૫૦ સો. ચાર્ડ, નિર્માણ સે હાઉસ પાછળ, ચાંદલોડિયા થી ગોતા રોડ, સાંદલોડિયા, અમદાવાદ–૩૮૨૪૮૧ ખાતેની મિલકત.

તારીખ : ૦૪.૦૨.૨૦૨૩ અદ્યિકૃત અદ્યિકારી સ્થળ : અમદાવાદ ડીસીબી બેંક લીમીટેડ વતી

રીસોર્સ સપોર્ટ એજન્સી કાપડ સમિતિ (કાપડ મંત્રાલય, ભારત સરકાર) ટેલિ.(૦૨૨) દુદુપર૭૫૦૭/૫૬૩/૫૬૮ કન્સલ્ટન્સી સંસ્થા/કંપની પાસેથી દરખાસ્ત

મેક્રેટરી, કાપડ સમિતિ, સમર્થ સ્કીમના સમવર્તી મુલ્યાંકનના આચોજન માટે પ્રતિષ્ઠિત કન્સલ્ટન્સી સંસ્થાઓ/કંપનીઓ પાસેથી ઇ– પ્રોક્યુરમેન્ટ પ્રક્રિયા મારફત દરખાસ્ત આરએફપી) માટે અરજીઓ મંગાવે છે. વિગતવાર માહીતી સરકારી ઈ-પ્રોક્યુરમેન્દ પોર્ટલ https:/eprocure.gov.in/eprocure/app અને https://gem.gov.in પર જોદ શકાશે /સીધી ડાઉલોડ કરી શકાશે. સંપુર્ણ દસ્તાવેજો માટેની લિંક પણ ww.textilescommittee.gov.in ઉપર ઉપલબ્ધ છે.

<u>(આસ્એફપી) માટે અરજી મંગાવતી નોટીસ</u>્

ઈ–પ્રોક્યુરમેન્ટ પોર્ટલ પર આરએકપી જ્યા કરવાની છેલી તારીખ દ્દ કેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ સાંજે ૧૭:૦૦ વાગ્યે અથવા તે પહેલા છે.

CBC 41104/12/0002/2223

કાપડ સમિતિ, મુંબઇ

## મિલકતોની હરાજી –સહ–વેચાણની જાહેર નોટીસ

સિક્ચોરીટાછોશન અને રીકન્સ્ટ્ક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટસ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર એસેટોનું વેચાણ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્યોરીટાઇઝેશન એન્ડ રીકન્સ્ટૂક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ હેઠળ સ્થાવર એસેટોના વેચાણ માટે ઇ-હરાજા વેચાણ નોટીસ

આથી ખાસ કરીને દેવાદારો અને જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો સિક્ચોર્ડ કેડીટરને ગીરો/ચાર્જડ કરાયેલ છે, જેનો કબજો એસેટ રીકજ્સ્ટકશન કંપનીઇન્ડિયા લી. (આર્સિલ), સરફૈસી એક્ટ, ૨૦૦૨ની જોગવાઇઓ હેઠળ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ એસેટ રીકજ્સ્ટુક્શન કંપનીઇન્ડિયા લીમીટેડ (આર્સિલ)ના અધિકૃત અદિકારીએ લઇ લીધો છે. આર્મિલે નીચેની નાર્ગાકિય એસેટો બેંકો/નાર્ગાકિય સંસ્થાઓ પાસેથી મેળવી છે અને સિક્યોર્ડ કેડીટરના હકો પ્રાપ્ર કર્યા છે. એસેટો "જ્યાં છે". "જે છે" અને "જેમ છે" ન ધોરણે નીચે જણાવેલ શીડ્યુલમાં આપેલ ટુંકી વિગતો અનુસાર વેચવામાં આવશે.

9	i aitu⊃ / tiksai	મુખ્ય કરજદાર/ સહ–કરજદાર/ જામીનદારનું નામ	ટ્રસ્ટનું નામ	મિલકતનો વિસ્તાર/પ્રકાર	બાકી લેણાંની રકમ રૂપિયામાં	બાનાની રકમ (ઇએમડી) રૂા. માં	અનામત કિંમત રૂા. માં	નિરીક્ષણની તારીખ	હરાજીની તારીખ અને સમય	કબજાનો પ્રકાર
9	HHOMSUR00 0 39828	શ્રી ગિરિશભાઇ જુવાનસિંહ બારીયા/શ્રી લતાબેન જી બારિયા	આર્સિલ રીટેઇલ લોન પોર્ટફોલિચો ૦૨૨–એ– ટ્રસ્ટ	ફ્લેટ /૫૭૯ ચો ફ્રુટ	રૂા. ૧૫,૧૨,૪૦૪.૩૨/– ૦૧–ફેબ્રુ–૨૩ મુજબ	₹ι. 8८,000.00/-	રૂા. ૪,૮૦,૦૦૦,૦૦/–	48–ફ્રેબ્રુ–	ર૧–ફેબ્રુ– ૨૦૨૩ બપોરે ૧૨:૩૦ ક્લાકે	ભૌતિક
G	મક્યોર્ડ મિલકતનું સ	<b>રનામું</b> ઃ ફ્લેટ નં. ૨૧૨, બ	ીજો માળ માળિ	ળા કોમ્પલેક્ષ, બ્લો	ક નં. ૪૫૭, ગોલ્ડન પ્લ	ાઝા પાછળ, <del>કે</del> નાલ	રોડ, મોજે કામરેજ,	તાલુકો કામ	જે, સુરત-૩૯૪૧	ico, ગુજરાત
5	428HML81890 283/ 428THL822594 33	શ્રી ઉદયસિંહ રાજપુરોહિત/ શ્રીમતી સોરમ	આર્સિલ રીટેઇલ લોન પોર્ટફોલિયો ૦૫૯-એ- ટસ્ટ	ફ્લેટ / <i>૭</i> ૬૦ ચો ફુટ	રૂા. ૨૨,૪૫,૩૪૩.૫૭/– ૦૧–ફેલ્યુ–૨૩ મુજબ	₹ι. 	રૂા. ૭,૦૦,૦૦૦.૦૦/–	૧૫–ફ્રેબ્રુ– ૨૩	૨૧–ફ્રેબુ– ૨૦૨૩ બપોરે ૦૨:૩૦ ક્લાકે	ભૌતિક ૧૩(૪)

રાજપુરોહીત વ્યલ્-અ- દ્રસ્ટ સિ<mark>ક્ચોર્ડ મિલકતનું સરનામું</mark>: ફલેટ નં. ૨૩૬, બીજો માળ, બિલ્ડીંગ નં. ડી–૯, રાજઅભિષેક સીટી હોમ્સ, સરિન પલાસણા રોડ,ન્યુ બ્લોક નં. ૧૪, રેવન્યુ સર્વે નં. ૧૪, મોજેકાનડે

מוי	લુકા ચાયાસા, સુર <b>્</b>	1–368530, ગુજરાત.			S					
3		શ્રી વિક્રમસિંહ રાઠોડ	આર્સિલ	ફ્લેટ/૮૧૦.૩૧	રા. ૩૩,૦૪,૭૬૭.૯૧/–	રૂા. ૧,૫૫,૦૦૦/–	રૂા. ૧૫,૫૦,૦૦૦/–	૧૬–ફ્રેબુ–	ર૧–ફ્રેબુ–	ભૌતિક
	876 & 600207510156	/ શ્રીમતી જ્યોતિબેન	રીટેઇલ લોન	ચો ફ્રુટ	૦૧–ફ્રેબ્રુ–૨૩ મુજબ			₹3	२०२३	
	792	,	પોર્ટફોલિયો						બપોરે ૦૪:૦૦	
	192	રાઠોડ/મેસર્સ વર્ચસ્વ	૦૬૧–એ–						કલાકે	
		સોકાસ	252							

સિક્ચોર્ડ મિલકતનું સરનામું: ફ્લેટનં. ૨૦૩, બીજો માળ, બિલ્ડીંગ નં. સી/૩, સુર્યાંજલી રેસીડેન્સી, સંસ્કાર રેસીડેન્સી સામે , ટાઉન પ્લાનિંગ નં. ૭૦, પ્લોટ નં. ૨૯૨ , કોસદ રોડ

J.,	cic, cycar score	,o, - <u>,</u> 12.00.								
	0239	શ્રીમતી સુનિતાબેન પી પાટીલ/ શ્રી પ્રવિણ પાટિલ	આર્સિલ રીટેઇલ લોન પોર્ટફોલિયો ૦૪૫–બી– ટ્રસ્ટ	ફ્લેટ / ૪૫૦ ચો ફ્રુટ	રૂ ૪૦,૮૯,૫૪૭.૨૫/– ૦૧–ફ્રેબ્રુ–૨૩ મુજબ	રૂા. ૫૦,૦૦૦.૦૦/–	રૂા. ૫,૦૦,૦૦૦.૦૦/–	ર3−ફ્રેબ્રુ− ૨3	૦૭–માર્ચ– ૨૦૨૩ બપોરે ૧૨:૩૦ ક્લાકે	ભૌતિક
<b>~</b> .	> 4 C 1		-0-1	- 1 1 1	17 - 7 0 - 0 :	0	A &		\ · Y •	C /21

સિ<mark>ક્યોર્ડ મિલકતનું સરનામું</mark>: ફ્લેટનં. ૨૦૩, બીજો માળ, ઓઢવ સુષ્ટિ એપાર્ટમેન્ટ, કે.ડી.બી ઇંગ્લીજ્ઞ સ્કુલ પાસે, સર્વે નં. ૧૨૩/પૈકી, પ્લોટ નં. ૧૯, બ્લોક સર્વે નં. ૧૨૩/પૈકી ૧૬/પૈકી ૨, ભિલાડ, સારીગામ, ફાનસા રોડ, મોજે સારી ગામ, પેટા જિલો ઉમરગૉંવ, જિલો વલસાડ–૩૯૬૧૦૫, ગુજરાત. પ SHLHSRAT000 શ્રીમતી સનિતાબેન આર્શિલ ક્લેટ / ૭૨૧ રા. ૪૦,૮૯.૫૪૭,૨૫/– ૦૩−૬ેભ− ૦૭−માર્ગ− ભૌતિક

	0238/ SHLHSRAT000 0239	પી પાટીલ/શ્રી પ્રવિણ પાટીલ	રીટેઇલ લોન પોર્ટફોલિયો ૦૪૫–બી– ટ્રસ્ટ	ચો ફુટ	૦૧–ફેબ્ર–૨૩ મુજબ	co,ooo.oo/-	c,00,000.00/-	23	૨૦૨૩ બપોરે ૦૧:૦૦ કલાકે	
10		! _ X _ !	-0-1		- 2 0 - 0 0	Y :	12	!	_ Y ! B	1 2 12 1

સિ**ક્ચોર્ડ મિલકતનું સરનામું**: ફ્લેટનં. ૨૦૨, બીજો માળ ઓઢવ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, કે.ડી.બીઇગ્લીશ સ્કુલ પાસે, ાર્વે નં. ૧૨૩/પૈકી, પ્લોટ નં. ૧૯, બ્લોક સર્વે નં. ૧૨૩/પૈકી, ૧૬/પૈકી ૨, ભિલાડ, સારીગામ, ફાનસા રોડ, મોજે સારી ગામ, પેટા જિલો ઉમરગૉલ, જિલો વલસાડ–૩૯૬૧૦૫, ગુજરાત.

	۱,	1106922/ICI CI Bank Ltd	અરોવદભાઇ ગાડાભાઇ ચાવડા/મધુબેન અરવિંદભાઇ ચાવડા/રમણભાઇ પુરષોત્તમભાઇ વણકર	આસલ રીટેઇલ લોન પોર્ટફોલિચો ૦૦૧–એ– ટ્સ્ટ		રા. ૨૨,૬૪,૬૯૦.૩૩ <i> </i> - ૨૧/૦૧/૨૦૨૩ મુજબ	₹ι. 3७,૫૦૦.૦૦/−	રૂા. ૩,૭૫,૦૦૦.૦૦/−	43/04/40 43	09/03/૨૦૨૩ બપોરે ૧૨:૦૦:૦૦ ક્લાકે	ભાાતક
			નું સરનામું: બ્લોક નં. ૧૫	૬, પ્લોટ નં. ૩	૦, શુશાંત પાર્ક, ક	પ્રેચસ પાર્ક પાછળ, મો	જે ઇશારામ , તાલુ	કો પેટલાદ, જિલો	આણંદ– ૩૮	૮૪૫૦, પિનકો	S-3८८४ <b>५</b> ०.
ſ		LBJGH00000	મનિષ જગજિવનભાઇ	આર્સિલ	જમીન : ૫૧ ચો	રૂા. ૪૧,૦૪,૯૪૪.૬૨/–	રૂા.	રૂા.	૨૧/૦૨/૨૦	09/03/2023	ભૌતિક
ı		722594/ICICI Bank Ltd	ઉનડકટ/ભાવના	રીટેઇલ લોન	ચાર્ક	૨૧/૦૧/૨૦૨૩ મુજબ	६२,०००.००/-	६,२०,०००.००/-	₹3	બપોરે	
ı	- 1	Dankeu	મનિષ ઉનડકટ	પોર્ટફ્રોલિયો	ફ્લેટ/૫૧					93:30:00	
ı	- 1		मानव एनऽ५८	૦૦૧–એ–	ચો ચાર્ડ					કલાકે	
ı				555	(ફ્રીહોલ્ડ)						

સિ<mark>ક્ચોર્ડ મિલકતનું સરનામું:</mark> બેલકનં. ૩, પ્લોટનં. ૪૭, પૈકી નારાચણ નગર, રેવન્યુ સર્વે નં. ૧૩૦/૧ પૈકી, ૧૩૦/૨ પૈકી, મારૂતિ નગર પાસે, ખાંભરોલ રોડ, તચ્બા મસ્જિદ પાસે

[	જિલો જુનાગઢ–૩૬૨૦૦૧, પિન કોડ– ૩૬૨૦૦૧.										
4	6038072102	મેહુલભાઇ જી પરમાર/	આર્સિલ	જમીન : ૩૨૦ ચો	રૂા. ૨૫,૭૩,૦૫૯.૦૨/–	રા. ૯૫,૦૦૦.૦૦/−	રૂા.	<b>98/05/50</b>	२१/०२/२०२३	ભૌતિક	
l	23659/fullert On India	કાજલબેન મેહલકમાર	રીટેઇલ લોન	્ ફ્રેંડ	૨૧/૦૧/૨૦૨૩ મુજબ		e,40,000.00/-	23	બપોરે		
l	Housing	પરમાર	પોર્ટફોલિયો	ફ્લેટ / ૩૨૦					૧૨:૦૦:૦૦		
	Finance	42-412	૦૬૧–એ–	ચી ફુટ (ક્રીહોલ્ડ)					કલાકે		
			555	(इस्टाट्ड)							

સિક્ચોર્ડ મિલકતનું સરનામું: યુનિટ નં. સી–૫૪, હુડકો રેવન્યુ સર્વે નં. ૨૪૯ પૈકી, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. દૃ, ફાઇનલ પ્લોટ નં. ૧૫૫, ફાયર બ્રીગેડ પાછળષ હુડકો સ્ટેશન પાસે,

ا	State at 10-16 13 14-1 313 35000€.									
G	HL/0190/H/1	ચંદુભાઇ એમ	આર્સિલ	જમીન : ૪૨૦ ચો	રા. ૨૮,૩૭,૦૪૧.૧૯/–	રા. ૫૮ ,૦૦૦.૦૦/-	રૂા.	98/05/50	२९/०२/२०२३	ભૌતિક
ı	3/100156/Ma gma Housing	દેવમુરારી/કિરણબેન	રીટેઇલ લોન	ક્ટ	૨૧/૦૧/૨૦૨૩ મુજબ		५,८०,०००.००/-	23	<b>બપો</b> રે	
П	Finance	દેવમરાર <u>ી</u>	પોર્ટફોલિયો	<del>ફ</del> લેટ / ૪૨૦					93:00:00	
П	(MHFL)	દવનુદાદા	૦૪૪–એ–	ચો ફ્રટ					કલાકે	
			ડક્ટ	(ફ્રી હોલ્ડ)					l, II	

**સિક્ચોર્ડ મિલકતનું સરનામું**: પ્લોટ નં. ૭૫, શિવ નગર, દાદા ભગવાન મંદિર પાછળ, રેવન્યુ સર્વે નં. ૩૬૦, બ્લોક નં. ૩૪૭, મોજે કામરેજ, સુરત–૩૯૪૧૮૦, ગુજરાત, પિનકોડ 368960 

	oorat	ાફરાજઅભ્યદ	આહાલ	જનાળ : અળ.અ.	\$1. 40,05,000.40 <i>j</i> -	QL.	۱ کړ.	43/05/50	44/04/4043	r-uu3
	0000107/shrir Am Housina	કરેશી/અમીના રશીદ	રીટેઇલ લોન	ક્ઝ૪ \ ક્છે <del>ટ</del>	૨૧/૦૧/૨૦૨૩ મુજબ	૫૦,૦૦૦.૦૦/-	ч,00,000.00/-	23	બપોરે	
	Finance Limited	] a ',	પોર્ટફ્રોલિયો	ચો ફ્લ્ટ				અને	93:30:00	
	(SHFL)	ઇષોદ અહમદ	૦૪૫–એ–	(ફ્રી હોલ્ડ)				93/02/20	કલાકે	
			ડક્ટ					23		
સિ	<b>સિક્યોર્ડ મિલકતનું સરનામું</b> : ફ્લેટ નં. ૨૦૨, બીજો માળ, બિલ્ડીંગ બી, સ્વર્ખ કુંજએપાર્ટમેન્ટ, ગોલ્ડન ફ્લેટસ સામે, ઉન નાકા બસ સ્ટોપ પાસે, રેવન્યુ સર્વે નં. ૧૮૮ પૈકી, ટાઉન									

પ્લાનિંગ નં. ૪૭, કોંઇનલ પ્લીટેનં. ૨૪, સીટી સર્વે નં. ૨૯૦ ૧ પૈકી, પ્લોટે નં. ૧ શ્રી ૧૬ અને ૮૨ શ્રી ૮૩, મોજે ભેરતાણ, તાલુકો અને જિજ્ઞો સુરત, પિન કોર્ડ-૩૯૫૦૨૩ ભૌતિક આર્સિલ હરેશભાઇ ઝવેરભાઇ જમીન : એન.એ. | રૂા. ૮૧,૪૬,૦૪૬.૧૭/– રૂા. રૂા. 93/02/20 29/02/2023 550/L&T રીટેઇલ લોન ચો ચાર્ડ ૨૧/૦૧/૨૦૨૩ મુજબ | ૧,૧૫,૦૦૦.૦૦/-99.40.000.00/ બપોરે ઢોલા/ વર્ષાબેન ફ્લેટ / ૪૮૭ 98:00:00 હરેશભાઇ ઢોલા ૫૮-બી- ટ્રસ્ટ ચો ફ્રુટ કલાકે

(ક્રી હોલ્ડ) સિક્યોર્ડ મિલકતનું સરનામું: શોપ નં. યુ/૭, પહેલો માળ, નોવા કોમ્પલેસ, રેવન્યુ સર્વે નં. ૬, પૈકી ઉત્તર બાજુપ્લોટ નં. ૩,૪,૭,૮,૧૧ અને ૧૨, સીટી સર્વે નં. ૪૨૪૯/૨, ૪૨૫૦/૨ ૪૨૫૨/૨, ૪૨૫૧/૨ અને ૪૨૫૮, નવો સીટી સર્વે નં. ૪૨૪૯/૨, ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૫૭, ફાઇનલ પ્લોટ નં. ૧૧/બી, ડૉ દક્શેશ્વર મંદિર, મોજે પાંડેસરા, પિનકોડ-૩૯૪૨૨૧ આર્સિલ જમીન : ૫૦૪ ચો 🛛 રા. ૨૫,૩૦,૩૧૪.૨૧/– 99/02/20 29/02/2023 ભરતભાઇ પુનાભઆઇ ₹L. 47111/Fullert રીટેઇલ લો ૰ ૨૧/૦૧/૨૦૨૩ મુજબ સોવસિયા/જશુબેન ડ્સ ξ4,000.00/ξ,40,000.00/ ₹3 બપોરે પોર્ટફોલિયો ફ્લેટ|૮૯૬ 94:00:00 Housing ભરતભાઇ સોવસિયા

૦૬૧–એ– ચો ફ્રુટ (ફ્રી હોલ્ડ) કલાકે აჯა **સિક્ચોર્ડ મિલકતનું સરનામું**: પ્લોટ નં. ૧૫૮, શ્રી કામદોનુ રેસીડેન્સી, રેવન્યુ સર્વે નં. ૫૧૬, બ્લોક નં. ૫૧૧, ગામ પિપોદરા, પેટા જિજ્ઞો માંગરોળ, પિનકોડ–૩૯૪૧૧૧.

આર્સિલ જમીન : ૪૪૦ ચો | રૂા. ૨૦,૬૧,૫૨૯.૦૮/– રૂા. ૬૫,૦૦૦.૦૦/-90/05/50 २९/०२/२०२३ સુરેશભાઇ ઉત્તમભાઇ 35049/Fullert રીટેઇલ લોન્ ૨૧/૦૧/૨૦૨૩ મુજબ બપોરે કુટ ξ,40,000.00/ ₹3 પાટીલ/ આશાબેન on India પોર્ટફોલિચો \$62 / 800 94:30:00 સુરેશભાઇ પાટીલ ૦૬૧–એ– કલાકે ચો ક્ટ Finance აჯა (ફ્રી હોલ્ડ)

**સિક્ચોર્ડ મિલકતનું સરનામું**. પ્લોટ નં. ૩૧૧, આરાધના પાર્ટ ૧, ગુજરાતી સ્કુલ પાસે, બ્લોકનં. ૧૫૯, (કેજેપી પછી બ્લોક નં. ૧૫૯/૩૧૧/એ), ગામ જોલવા, પલસાણા, પિનકોડ

368350. હરાજીની પ્રક્રિયાને લગતી અગત્થની માહિતી અહીં ઉપર જણાવ્યા મુજબ ય ઇએમડી સુપરત કરવાની છેલી તારીખ તેજ દિવસે હરાજીના ૨ કલાક પહેલા ૧ હિરાજીની તારીખ બીડ સુપરત કરવાનું સ્થળ અને ૬૧૦, ૬ક્ષે માળ, સન સ્કવેર, હોટલ રેગેન્ટા એન્ટ્રીમ, દ્દ ઇએમડી સહિતની તમામ ચુક્વણીઓ અમદાવાદ આઇડીએફ્સી બેંક આગળ, સી.જી. રોડ ૫ડખે, ડિમાન્ડ ડ્રાફ્ટના માર્ગે કરવાની રહેશે હકારીનું ક્હાળ નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૬. ગુજરાત. જે ચુક્વવાપાત્ર છે: <mark>બીડ ઓનલાઇન પણ સુપરત કરી શકાશે / ઓનલાઇન અથવા જતે, બ્રાંચના સ્થળે કોવીડ – </mark> છે ડિમાન્ડ ડ્રાફ્ટ જેની તરફેણમાં **સ્થિતિ પર આદારીત.** ashfaq.patka@arcil.co.in, krishna.gupta@arcil.co.in/piyush.gupta@arcil.co.in દરેક મિલકતની સામે ટ્રસ્ટ કોલમમાં નામ દર્શાવેલ છે. નિરિક્ષણનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે૫.૦૦ દરમિયાન www.arcil.co.in 3 હરાજીની વેબસાઇટ નોંધ: નિરિક્ષણની તારીખ અને સમય કોવીડ ૪ સંપર્ક કરવાની વ્યક્તિઓ અને શ્રીઅસ્કાક પતકા – ૯૮૧૯૪૧૫૪૭૭, કિષ્ના ગુપ્તા -૧૯ ની સ્થિતિને જોતા બદલાઇ શકે છે. ૯૧૬૭૩૪૩૭૩૫, પિચુષ ગુપ્તા – ૯૬૮૭૬૫૭૦૭૨

ં બીડર તેની ઇચ્છા અનુસાર જણાવેલ નમુનામાં અરજી કરીને હરાજીમાં ઓનલાઇન ભાગ લેવાની સુવિધા મેળવી શકે છે, જે અહીં ઉપર જણાવેલ વેબસાઇટ સરનામાં પર ઓફર/ટેન્ડર દસ્તાવેજો સહીત ઉપલબ્ધ છે. ઓનલાઇન બીડીંગ ઉપર જણાવ્યા મુજબ સંસ્થાની વેબસાઇટ પર કરવામાં આવશે અને ટેન્ડર દસ્તાવેજોમાં રહેલી શરતો અને નિયમોને આદ્યિન રહેશે. ટેન્ડર દસ્તાવેજો અને હરાજીની વિગતવાર શરતો અને નિયમો અમારી વેબસાઇટ <u>www.arcil.co.in</u> પરથી ડાઉનલોડ કરી શકાશે, અથવા ઉપર જ્યાવેલ **આર્સિલની** ઉપર જ્યાવેલ લાગતી વળગતી શાખામાંથી મેળવી શકાશે. મહેરબાની કરીને નોંધ લેવી કે વેચાણ બીડ દસ્તાવેજોમાં જ્યાવેલ શરતો અને નિયમોને આધિન રહેશે. વેચાણ કડકપણે આ જાહેરાતમાં જણાવેલ અને બીડ/ટેન્ડર દસ્તાવેજોમાં જણાવેલ શરતો અને નિયમોને આધિન રહેશે. અધિકૃત અધિકારી કોઇપણ કારણ જણાવ્યા વગર કોદપણ/તમામ બીડો રદ કરવાનો અનામત હક ધરાવે છે. આ નોટીસને સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમે ૨૦૦૨ ના નિયમ ૮ અને ૯ હેઠળ નોટીસ તરીકે પણ ગણવામાં આવશે

સ્થળ : ગુજરાત તારીખ : ૦૪.૦૨.૨૦૨૩

સહી/- અધિકૃત અધિકારી એસેટ રિકન્ટ્રક્શન કંપની (ઇન્ડિયા) લીમીટેડ

એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા લીમીટેડ. <u>CIN:</u>U65999MH2002PLC134884 િC 📗 <u>રજીસ્ટર્ડ ઓફીસઃ</u> દા રૂળી, ૧૦મો માળ, ૨૯ સેનાપતી બાપટ માર્ગ, દાદ૨ (પશ્ચિમ), મુંબઇ–૪૦૦૦૨૮, ફોન : ૦૨૨–દૃદૃ૫૮૧૩૦ **વેબસાઇટ**: <u>www.arcil.co.in</u> **શાખાનું સરનામું**: ૬૧૦, ૬ કો માળ, સન સ્કવેર, હોટેલ રેગેન્ટા સેન્ટ્રલ એન્ટ્રીમ, સી.જી. રોડ પર, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૬, ગુજરાત . **ફોન**: ૦૭૯–૪૦૩૦૬૩૦૧/૦૨

એવીઓમઇન્ડિયા હાઉસિંગ ફાચનાન્સ પ્રાઇવેટ લીમીટેડ રજીસ્ટર્ડ ઓફીસ : ૮૩ પહેલો માળ, પુર્વી માર્ગ, વસંત વિહાર, નવી દિલ્હી–૧૧૦૦૫હ CIN: U65993DL2016PTC291377

જાહેર નોટીસ

અાથી બોટીસ આપવામાં આવે છે કે એવીઓમ ઇન્ડિંગ ફાયનાન્સ પ્રાઇવેટ વીમીટેડ હાઉસિંગ ફાયનાન્સ કંપનીએ તેની શાખા ઓફીસ નીઓ એટ્રીયમ, ઓફીસ નં. ૪૦૬, ચોથો માળ અંબર સિનેમા સામે, પીએન માર્ગ, જામનગર–૩૬૧૦૦૮ થી ચોથો માળ, ૪૦૫, ૪૦૬, કોર્મસીચલ કોમ્પલેસ, શિવમ બેક્ટી ઉપર, જય માતાજી હોટેલ સામે, જોલી બંગલો, જામનગર, ગુજરાત-દ ૧૦૦૮ ખાતે ખસેડેલ છે.

ામામ લાગતા વળગતાઓને ઉપરોક્ત નોટીસની નોંધ લેવા વિનંતી છે. એવીઓમ ઇન્ડિયા હાઉસિંગ કાચનાન્સ પ્રાઇવેટ લીમીટેડ વર્ત

અધિકૃત સહિકત તારીખ : ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩

#### ASSAM POWER DISTRIBUTION COMPANY LIMITED (A Govt. of Assam Public Limited

TENDER NOTIFICATION

Assam Power Distribution Company Limited (APDCL) invites tender from the prospective bidders for the bid document "Design, Supply, Installation, Testing and commissioning including 5 years Operation, Comprehensive Warranty and Maintenance of High Mast Solar Street Lighting Systems at Hajo Rurban Cluster region in Kamrup District of Assam". The bid documents may be downloaded from www.apdcl.org or https://www.assamtenders.gov.in. Details will be available at www.apdcl.org or https://www.assamtenders.gov.in.

Sd/- Chief General Manager (NRE), APDCL Annex Building, Bijulee Bhawan, Paltanbazar, Guwahati - 1 Please pay your energy bill on time and help us to serve you better!

અલ્ગોક્વેન્ટ ફિનટેક લીમીટેડ (અગાઉ હિન્દુસ્તાન એવરેસ્ટ ટુલ્સ લીમીટેડ) CIN: L74110GJ1962PLC136701

રજીસ્ટર્ડ ઓફીસ : યુનિટ નં. ૭૦૫, સાતમો માળ, ઇસ્કોન એલિગન્સ, પ્લોટ નં. ૨૪, પ્રહલાદનગર, અમદાવાદ–૩૮૦૦૧૫. ગુજરાત ફોન : +૯૧ –૯૯૧૦૦૩૨૩૯૪, છમેઇલ : investors@algoquantfintech.com વેબસાઇટ : www.algoquantfintech.com ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પુરા થતાં ત્રિમાસિક અન-ઓડિટેડ અલાયદા નાણાંકિય પરિણામોનો સાર (રૂા. લાખમાં, શેર દિઠ કમાણી સિવાય) નવ માસિકનાં ગાળાનાં અંતે ત્રિમાસિક ગાળાનાં અંતે वर्षना अंते 31-12-2022 30-09-2022 31-12-2021 31-12-2022 31-12-2021 31-03-2022 અનઓડિટેક અનઓડિટેક અનઓડિટેડ અનઓડિટેડ અનઓડિટેક ઓક્ટિક કામકાજમાંથી ફુલ આવક 582.02 719.78 516.67 1291.34 1176.23 1710.33 ાળાનો ચોખ્ખો નફો/(તોટો)(વેરા, અપવાદ3પ ગીજો અને*|*અથવા અસાધારણ ચીજો પહેલા) 197.77 362.58 22.02 367.94 261.92 316.42 ગેરા પુર્વે ગાળાનો ચોખ્ખો નફો /(તોટો) અપવાદરૂપ ચીજો અને અસાધારણ ચીજો પછી) 197.77 362.58 22.02 261.92 316.42 ગેરા પછી બંધ કામકાજોમાંથી ચોખ્ખો નફો /(તોટો) અપવાદરૂપ ચીજો અને અસાધારણ ચીજો પછી) (2.81)0.00 15.74 24.70 19.08 ાળાની કુલ સમાવેશક આવક (ગાળાનો કુલ સમાવેશક નફો/તોટો (વેરા પછી) મને અન્ય સમાવેશક આવક (વેરા પછી) સહીત) 592.10 190.81 (85.58)1006.56 921.28 1342.75 મરપાઇ થયેલ શેરદીઠ મુડી (પ્રતિદીઠ રૂા. ૨/- ની મુળ કિંમત) 160.72 160.72 160.72 160.72 160.72 160.72 અન્ય ઇક્વિટી 3193.45 ચાલુ કામકાજમાંથી શેરદીઠ કમાણી (વાર્ષિક નહી) (એ) મુળ (રૂા.માં) 2.26 3.31 3.94 2.94 4.03 3.94 2.26 3.31 0.31 2.94 4.03 (બી) ઘટાડેલી (રૂા.માં) બંધ કામકાજોમાંથી શેર દીઠ કમાણી,(તોટો) (વાર્ષિક નહી) (એ) મુળ (રૂા.માં) 0.31 (0.04)0.24 \_\_\_\_ (બી) ઘટાડેલી (રૂા.માં) (0.04) 0.27 0.00 0.20 0.31 0.24 યાલુ અને બંધ કામકાજોમાંથી શેર દીઠ કમાણી,(તોટો) (વાર્ષિક નહી) 2.22 3.58 0.31 3.25 4.27 (એ) મુળ (રૂા.માં) 2.22 3.58 0.31 (બી) ઘટાડેલી (ગ્રા.માં)

ર ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજપણ થતાં ત્રિમાસિક ગાળાના અન-ઓડિટેડ અલાયદા નાગાંકિય પરિભાોના ઉપરોક્ત નિવેદન( નિવેદ) ની ઓડિટ કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવીહતીઅને બોર્ડઓફ્ ડાયરેક્ટર્સે ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજચોજાયેલ તેનીબેઠકમાં મંજુર કર્યા હતાં. સ્ટેસ્યુટરી બોડિટેરોએ નિવેદન પર સદ્યારા વગરનો મત આપ્યો હતો.

. નાણાંકિય પરિણામો કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૩૩ સાથે વંચાતા તે હેઠળ બનેલ સંબંધિત નિયમો હેઠળ નિયત ભારતીય એકાઉન્ટીંગ

પ્રોરણોની માન્યતા અને માપન અને ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત અન્ય એકાઉન્ટીંગ સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવેલ છે. 3. સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્ક્લોઝર રીક્વાચરમેન્ટ્સ) નિયમનો, ૨૦૧૫ ના નિયમન ૩૩ હેઠળ સ્ટોક એક્સરોન્જમાં ફાઇલ કરેલ ત્રિમાસિક નાણાંકિચ પરિણામોની વિગતવાર માહિતીનો સાર ઉપર મુજબ છે. ત્રિમાસિક અલાચદા નાણાંકિચ પરિણામોની પુરેપુરી માહિતી મેક્સરોજ્જની વેબસાઇટ www.bseindia.com અને કંપનીની વેબસાઇટ www.algoquantfintech.com ઉપર ઉપલબ્ધ છે.

બોર્ડ ઓફ ડાચરેક્ટર્સ વતી અને માટે અલ્ગોક્લેન્ટ ફિનટેક લીમીટેડ સહી/-દેવાંશ ગુપ્તા મેનેજિંગ ડાયરેક્ટર

ડીઆઇએન: ૦૬૯૨૦૩૭૬

તારીખ: ૦૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ ચળ: નવી દિલ્હી

# ટાટા કેપિટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ

રજીસ્ટર્ડ ઓફીસ : ૧૧મો માળ, ટાવરએ, પેનિનસુલા બિઝનેસ પાર્ક, ગણપતરાવ કદમ માર્ગ, લોઅર પારેલ, મુંબઇ – ૪૦૦૦૧૩ શાખાનું સરનામું : ચોથો માળ, શાંતિ એનેસ, બી ડી પટેલ હાઉસ સામે, સરદાર પટેલ સ્ટેચ્ય્ પાસે, નારણપૂરા, અમદાવાદ

સ્થાવર મિલકતના વેચાણ માટે નોટીસ

(સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૯ (૧) હેઠળ) સિક્ચોરિટી ઇન્ટ રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ નો નિયમ ૯(૧) સાથે વંચોતા સિક્ચોરિટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયા એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ–હરોજી નોટીસે

ખાંથી ખાસ કરીને નીચે જણાવેલ દેવાદાર / સહ−દેવાદારને અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો ટાટ કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ(ટીસીએચએફએલ) ને ગીરો કરાયેલ છે, જેનો ભૌતિક કબજો ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ (ટીસીએચએફએલે) ના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે જેનું "જ્યાં છે", "જેમ છે" અને "જે છે" ના ધોરણે નીચે જણાવેલ દેવાદાર અને સહ વાદાર પાસેથી બાકી લેણાંની કુલ રકમની વસુલાત માટે **૧૭.૦૩.૨૦૨૩** ના રોજ વેચાણ કરવામાં આવશે. રીઝર્વ કિંમત અને અર્નેસ્ટ મની ડિપોઝીત નીચે મુજબ જણાવેલ છે. આથી નોટીસ આપવામાં આવે છે કે વેચાણની કોઇપણ મૌકુફી / બંધની ગેરહાજરીમાં નોટીસમાં જણાવેલ રકમ બાકી રહેતી ટકમ માટે જ્યાવેલ સિક્ચોર્ડ મિલકત/ મિલકતનું લાગતી વળગતી શાખાઓએ જ્યાવેલ **૧૭.૦૩.૨૦૨૩ ના રોજબપોરે ૨.૦૦ કલાકે** ઈ–હરાજી દ્વાર રેચાણ કરવામાં આવશે. ઈ–હરાજીમાં ભાગ લેવા માટે ડીમાન્ડ ડાક્ટ ધરાવતા સિલબંધ એન્વેલોપ ટીસીએચએકએલના અધિકત અધિકારીને **૧૬.૦૩.૨૦૨૩ ના સેજસાંજે૫.૦૦ કલાક** સુધી શાખા ઓફીસ: ટાટા કેપીટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડ, ચોથો માળ, શાંતિ એનેક્સ, બીડી પટેલ રાઉસ સામે, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, નારણપુરા, અમદાવાદ ખાતે સુપરત કરવાના રહેશે

સિક્ચોર્ડ એસેટ / સ્થાવર મિલકતનું વેચાણ નીચે આપેલ ટુંકી વિગતો મુજબ "જ્યાં છે, ત્યાં" ની શરતે કરવામાં આવશે

ક્રમ નં.	 દેવાદાર(રો)/સહ-દેવાદાર(રો) / કાનુની વાસ્સદાર(રો)/ કાનુની પ્રતિનિદી(ઓ)/ જામીનદાર(રો) ના નામ	માંગણા નોટીસ મુજબ રકમ	રિઝર્વ સ્ક્રમ	અર્નેસ્ટ મની	
1.	શ્રી મુનાભાઇ ઇસ્માઇલભાઇ મણિચાર, શ્રીમતી અનિષાબેન મુનાભાઇ મણિચાર	રૂા. ૧૦,૭૮,૮૬૯/– (રૂપિયા દસ લાખ ઈકોત્તેર હજાર આકસો ઓગણસીતેર પુરા) —————— 30–૦૪–૨૦૨૧	રૂા. ૭,૫૦,૦૦૦/– (રૂપિયા સાત લાખ પસ્થાસ હજાર પુરા)	ગ્ન. ૭૫,૦૦૦/– (રૂપિયા પંચોતેર હજાર પુરા)	

**સ્થાવરામલકતના ાવગત**: ફલટ ન .૩૦૩,૩જામાળ,સુપરાબલ્ડ અપ આરચા ક્ષત્ર ફળ ૬૨.૭૧ ચા.મા.અટલ ક.૭૫.૦૦ ચા.ચાડ,ાબલ્ડાગ ન નીચેની જમીનમાં ન લહેચાચેલ હિસોસ અને ટી.કે આહિલ હાઇટ તરીકે જાણીતા પ્રિમાઇરીસ/કેમ્પસના તમામ અંદર અને બહારના હકે ધરાવતી સીટી સર્વે નં. ૧૩૬૭, ૧૩૬૮, શીટ નં. ૨૧, ચલતા નં. ૮૩,૭૫, નગરપાલિકા આકરણી નં. ૧૦૨૯, ૧૦૩૨, ની રેસીડેન્સીયલ હેતુસરન બેન ખેતીલાચક જમીન પર બંધાંચેલ મોજે ગામ પેથાપુર,તાલુકો ગાંધીનગર,પેટા જિલો અને જિલો ગાંધીનગર, ગુજરાત રાજ્ય ખાતેન સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. ચતુ:સીમાં: પૂર્વ: કંપાઉન્ડ, પશ્ચિમ: ફ્લેટનં. ૩૦૪, ઉત્તર: ફ્લેટનં. ૩૦૨, દક્ષિણ: સોસાયટીનો

2.	93135	શ્રીમતી અંચલા	રૂા. ૫૪૪૩૦૨/– (રૂપિયા પાંચ લાખ ચુંમાલીસ હજાર ત્રણસો બે પુરા)	રા. ૧૬,૬૩,૨૦૦/–	રૂા. ૧,૬૬,૩૨૦/–
	27 &	દેસાઇ વર્મા,	એગ્રીમેન્ટ નં. ૧૦૬૮૩૯૮૨ હેઠળ તમારા દ્વારા બાકી અને ચુકવવા	(રૂપિયા સોળ લાખ	(રૂપિયા એક લાખ
	10683	શ્રી અરૂણ	પાત્ર અને રૂા. ૯૨૨૩૮૬/– (રૂપિયા નવ લાખ બાવીસ હજાર ત્રણસો	ત્રેસઠ હજાર	છાસહ હજાર ત્રણસો
	982	શિવદચાલ	છચાંશી પુરા ) એગ્રીમેન્ટ નં. ૯૩૧૩૫૨૭ હેઠળ તમારા દ્વારા બાકી અને	બસ્સો પુરા)	વીસ પુરા)
		સિંઘ	ચુકવવા પાત્ર રૂા. ૧૪૬૬૬૮૮/– (રૂપિયા ચૌદ લાખ છાસઠ હજાર છસ્સો		
			ઈઠયાંશી પુરા )		
			<b>१८-०</b> ६-२०२ <b>१</b>		
			· ·		

**સ્થાવર મિલકતની વિગતઃ** ફ્લેટનં.સી/૪૦૪, ચોથો માળ, બ્લોક–સી, ક્ષેત્રફળ બિલ્ટ અપ એરિયા ૩૬.૭૮ ચો.મી. તેમજ ૬૬.૮૦ ચો.મી. ,રોડ પાર્કિંગ, ગેટ અનેસ ીઓપી વગેરેની જ્મીનમાં હિસેસ , બિલ્ડીંગ નીરોની જ્મીનમાં ન વહેરાયેલ હિસો અને રાજહંસ રેસીડેન્સી તરીકે જાણીતી પ્રિમાઇસીસે/કમ્પસના તમામ અંદર અને બહારના હકો દરાવતી સર્વે નં. ૪૧૨/૧. ટાઉન પલનિંગ સકીમ નં. ૧૧૦ (નિકોલ), ફાઇનલ પ્લોટ નં. ૩૭/૧, ક્ષેત્ર ફળ ૨૦૯૬ ચો.મી., મોજે ગામ: નિકોલ, તાલુકો– અમદાવાદ સીટી–પુર્વ, પેટો જિતો અમદાવાદ– ૧૨ (નિકોલ) જિલો અમદાવાદ, ગુજરાત ખાતેની સ્થાવર મિલકતના તમામ ભાગ અને હિસ્સા. રાતુ:સીંમા:પુર્વ: ખુલી જમીન, પશ્ચિમ: ફ્લેટ નં. સી/૪૦, ઉત્તર: ફ્લેટનં. સી/૪૦૩, દક્ષિણ: ખુલી જગ્યા.

હરાજીમાં જાહેર જ્નતાને વ્યક્તિગત રીતે તેમની બીડો સુપરત કરવા આમંત્રણ છે. દેવાદાર(રો)/સહ–દેવાદારોને આથી આ નોટીસ મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર કુલ બાકી રકમ તેમજ ચડત વ્યાજ પરત ચુકવવાની છેલી તક આપવામાં આવે છે, જેમાં નિષ્ફળ જતાં, જણાવેલ સ્થાવર મિલકત નીચે શીડ્યલ મુજબ વેચવામાં આવશે. ઈ–હરાજા અટકાવવામાં આવશે, જોઉપર જણાવેલ બાકી લેણાની રકમ ઈ–હરાજાની તારીખ પહેલા ચાજઅને ખર્ચ (વેંચાણના ખર્ચ સહિત) અધિકૃત અધિકારીને ચુકવવામાં આવે છે અથવા આવા સિક્ચોર્ડ દેવા, ત્યાજઅને ખર્ચની રકમ ચુકવવામ માવેલ છે તેવા સંતોષકારક પુરાવા આપવામાં <mark>આવ</mark>શે.

આ વેચાણ સાથે સંકળાયેલ અધિકારી અથવા કે અન્ય વ્યક્તિ સીધી કે આડકતરી રીતે બીડ કરવા કે વેચાયેલ મિલકત માથે કોઇ હિત મેળવવા હિત મેળવવાનો પ્રચાસ કરી શકશે નહી.

વેસાણ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ માં જણાવેલ શરતો અને નીચે જણાવેલ અન્ય શરતોને આદિન રહેશે : **નોંધ:** ઈ–હરાજી પોર્ટલ https://bankauctions.in/ મારફત **૧૭.૦૩.૨૦૨૩** ના રોજ બપોરે ૨.૦૦ થી ૩.૦૦ દરમ્યાન પ્રતિદીઠ ૧૦ મીનિટના મર્યાદિ

**શરતો અને નિયમો** : ૧. અહીં નીચે શીડ્યુલ્ડમાં જ્યાવેલ વિગતો નીચે સહી કરનારની શ્રેષ્ઠ માહિતીમા જણાવાયેલ છે, પરંતુ *ની*ચે સહી કરનાર અ દ્યોપણામાં કોઇપણ ભૂલ, ખોટા નિવેદન કે ચૂક માટે જ્વાબદાર ગણાશે નહી. બીડની રકમમાં ઉભા થતાં કોઇપણ વિવાદના કિસ્સામાં અથવા બીડરન ક્સ્સિમાં લોટની ફર્રીથી હરાજી કરવામાં આવશે. ૨) મિલકત રિઝર્વ કિંમતથી ઓછામાં વેચવામાં આવશે નહી. ૩) બીડ વૃદ્ધિની રકમ રૂા. ૧૦,૦૦૦/ (રૂપિયા દસ હજાર પુરા) રહેશે. ૪) મિલકતની ખરીદી માટે સુપરત કરાચેલ તમામ બીડો ઉપર જ્યાવેલ બાનાની રકર્મ "ટાટા કેપિટલ હાઉસિં નચનાન્સ લીમીટેડ<sup>"</sup> ની તરફ્રેણમાં શાખાના સરનામે ચુકવર્વા પાત્ર ડિમાન્ડ ડ્રાફ્ટના માર્ગે ઉપર જણાવેલ અર્નેસ્ટ મની સાથે મોકલવાની રહેશે અસફળ બીડરોને હરાજી પછી ડિમાન્ડ ડ્રાફ્ટ પરત કરવામાં આવશે. એનઇએફટી/આરટીછુએસ/આઇએમપીએસ મારફત ઇએમડીની ચુકવણી માટે અધિકૃત અધિકારીનો સંપર્ક કરવા વિનંતી છે. ૫) સૌથી ઉચી બોલી બોલનારને સફળ બીડર તરીકે ઘોષીત કરવામાં આવશે. જણાવવાનું તે/તેણીકાર્નુની રીતે બીડ કરવા લાયક હશે અને વધુમાં તેના દ્વારા બીડ કરાયેલ રકમ અનામત કિંમતથી ઓછી નહી હોય. સર્વોસ્થ બીડની સ્વીકૃતીની ાનાઇ કરવાની અધિકૃત અધિકારીની વિવેકબુર્લિ અનુસાર રહેશે, જ્યારે ઓફ્રર કરાયેલ કિંમત સ્પષ્ટપણે અપુરતી લાગે કે તેમને તેનો સ્વીકાર કરવાનું સલાહભર્યું ન લાગે. ૬)જણાવેલ કારણોસર વેચાણ મૌકુફ/બંધ રાખવો તે અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર રહેશે. ૭)મિલકતનું નિરક્ષિણ આગોતરી મુલાકાત દ્વારા **૦૯.૦૩.૨૦૨૩** ના રોજસવારે ૧૧ થી ૫ વાગ્યા સુધી કરી શકાશે. ૮) સફળ બીડર તરીકે ઘોષીત કરાયેલ વ્યક્તિએ આર્વ દ્યોપણા પછી તરત જ રજ કલાકની અંદર ખરીદ/બીડની રકમના પસ્ત્રીસ ટેંકા જ્યા કરવાના રહેશે જેમાં અધિકૃત અધિકારીને ચુકવાયેલ ઇએમડીની ટકમ બાદ કરવામાં આવશે અને આ જમા કરવામાં કસુરના કિસ્સામાં મિલકતની નવી હરાજી/વેચાણ કરવામાં આવશે/ખાનંગી સંધિથી વેચવામ ખાવશે. ૯) જો ઉપર જણાવ્યા અનુસાર શરૂઆતી રકમ જમા કરવામાં આવે તેવા કિસ્સામાં ખરીદ કિંમતની બાકીની રકમ અધિકૃત અધિકારીને મિલકતના વેચાણની મંજુરીની તારીખથી ૧૫ દિવસે અથવા તે પહેલા ચુકવાની રહેશે અથવા ૧૫મો દિવસ રવિવાર કે અન્ય રજા હોય તો ૧૫ દિવસ પછીના પ્રથમ ઓફીસ દિવસે ચુકવવાની રહેશે. ૧૦) ઉપર જણાવેલ ગાળામાં કોઇપણ ચુકવણીના કસુરમાં, મિલકતની નવી હરાજી/વેચાણ કરવામાં ખાવશે અને ખાનગી સંધિથી વેંચવામાં આવશે. ડિપોઝીટ તેમજઇએમડી ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ દ્વારા જાર કરવામાં આવશે અને કસુરવાર મરીદાર મિલકતના તમામ દાવાઓ ગુમાવશે. ૧૧) ટાટા કેપિટલ હાઉસિંગ ફાચનાન્સ લીમીટેડની જાણમાં કોઇપણ બોજાઓની વિગતો જેના મા મેલકત જવાબદાર છે: નથી. દાવાઓ જો કોઇ હોય તો તે મિલકતની સાથે જશે અને તેના પ્રકાર અને ભાવ સાથે રહેલી અન્ય ખાસ બાબતો: નથી ૧૨) વિગતો, મદદ, પ્રક્રિયા, ઇ–ઓક્શન પર ઓનલાઇન તાલીમ માટે ભાવી બીકરો સર્વિસ પ્રદાતા મેસર્સ ફોરક્લોજર, બ્લોક નં. દૃ૦૫એ, છઠ્ઠો માળ નૈત્રીવનમ કોર્મસીચલ કોમ્પલેક્ષશ્ન, અમીરપેત, હૈદરાબાદ, ૫૦૦૦૩૮નો તેના કોઓર્ડીનેટર્સ, શ્રી યુ સુબ્બારાવ,, મોબાઇલ નં. ૮૧૪૨૦૦૦૦૬૧ subbarao@bankauctions.in અથવા શ્રી મનિષ બંસલ ઇમેઇલ આઇડી Manish.Bansal@tatacapital.com, અધિકૃત અધિકારી મોબાઇલ નં. ૮૫૮૮૯૮૩૬૯૬ પર સંપર્ક કરી શકે છે. તમારા પ્રશ્નો વોટ્સઅપ નંબર ૯૯૯૯૦૭૮૬૬૯ ઉપર મોકલવા વિનંતી છે. ૧૩) સૌથી ઉચી બીડ ૨કમ તરીકે દોષીત થયેલ સૌથી ઉચા બીડરે ૧ ટકા ટીડીએસ ચૂકવવાનું રહેશે. ચુકવણી માવિક/દેવાદાર(રો) ના પેનમાં સર્વોચ્ચ બીડર દ્વારા જ્યા કરવા જરૂરી છે અને ચલણની નકલ અમારી કંપનીને સુપરત કરવાની રહેશે. ૧૪) ઉપરની વિગતો માટે સિક્યોર્ડ લેણદારની વેબસાઇટમાં આપેલ લિંક https://bit.ly/3jndDvU જોવા વિગંતી છે. ૧૫) વધુ વિગતો માટે link.https://www.tatacapital.com/property-disposal.htms ગો સંપર્ક

**નોંધ** : ટીસીએચએ ફએલે આ મિલકતના વેચાણ/હરાજી માટે જણાવેલ ઓક્શનીંગ ભાગીદાર સિવાય કોઇપણ બ્રોકર/એજન્ટની નિમણંક કરી નથી. રસ ધરાવતી વ્યક્તિઓએ આ બાબતમાં તમામ પ્રશ્નો અને પૂછપરછ માટે ફક્ત નીચે સહી કરનાર અથવા અધિકૃત અધિકારીનો સંપર્ક કરવો જોઇએ

સ્થળ : અમદાવાદ તારીખ : ૦૪.૦૨.૨૦૨૩

સહી/– અધિકૃત અધિકારી ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાંન્સ લીમીટેડ

### GALAXY AGRICO EXPORTS LIMITED

Regd. Jai Kishan Industires Estate, Survey No.236, Behind Murlidhar Weigh Bridg Ph.91-2827-252676,252990. Fax.254371 E-Mail: mike@galaxyagrico.com info@galaxyagrico.com

Web: www.galaxyagrico.com CIN L01110GJ1994PLC021368 NOTICE

the Board of Director of the compa will be held on Thursday 9th February at the registered office of the compan at 4.00 pm to consider and place on record the Un-Audited Financial Result of the company for the 3rd Quarter ended 31st December 2022

For GALAXY AGRICO EXPORTS LIMITED Place : Veraval (Shapar)
Whole Time Director

Regd. Jai Kishan Industires Estate

Survey No.236, Behind Murlidhar Weigh Bridge, Veraval (Shapar) Dist. Rajkot Ph.91-2827-252676,252990. Fax.254371 E-Mail: mike@galaxyagrico.com info@galaxyagrico.com Web: www.galaxyagrico.com

> CIN L01110GJ1994PLC021368 NOTICE

Notice is hereby given that meeting of the Board of Director of the company will be held on Thursday 9th February at the registered office of the company at 4.00 pm to consider and place on record the Un-Audited Financial Result of the company for the 3<sup>rd</sup> Quarter ended 31<sup>st</sup> December 2022

For GALAXY AGRICO EXPORTS LIMITED Manoj H. Shah Place : Veraval (Shapar) Whole Time Director Date: 04-02-2023